

ત્વરિત જાહેરાત માટે

## જૂન 27 ના રોજથી ડાઉનટાઉન બ્રેમ્પટનમાં બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટ સુરક્ષાના ઉપાયો સહ શરૂ થશે.

બ્રેમ્પટન, ઓન્ટારિયો (19 જૂન 2020) – જેની આતુરતાથી રાહ જોવાની હતી તે બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટ ફરી આ ઋતુ માટે COVID-19 સામે સુરક્ષાના ઉપાયો સહિત આવી રહી છે.

માર્કેટ દર શનિવારે જૂન 27 થી 24 ઓક્ટોબર 2020 સુધી સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. માર્કેટ શરૂ થવાના નવા સમયથી ખરીદી માટે શેરીને સુરક્ષિત કરવાની વ્યવસ્થા કરી શકાશે.

તાજા સ્થાનિક ઉત્પાદો અને તૈયાર કરાયેલ પેકેજ કરેલ ખાદ્ય પદાર્થો વેચવા માટે તમારા અનેક ચાહકોના ખેડુતો અને વિક્રેતાઓ ફરી આવશે. કારીગરો દ્વારા તૈયાર થયેલ હસ્તકલાની વસ્તુઓ તેમજ સ્થળ પર બનાવાતા ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ રહેશે નહીં. COVID-19 ના રોગચાળા દરમિયાન સમાજનું આરોગ્ય અને સુરક્ષા સિટી માટે અગ્રીમ હોવાથી સુરક્ષાની વ્યવસ્થા રખાશે.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન હેઠળ સિટી ઓફ બ્રેમ્પટન નીચેના સુરક્ષા ઉપાયોનો અમલ કરશે:

- તમામ વિક્રેતાઓ અને ગ્રાહકો માટે માર્કેટમાં હોય ત્યારે બિન-તબીબી માસ્ક પહેરવા અથવા ચહેરા ઢાંકવો જરૂરી છે
- આખા માર્કેટમાં હેન્ડ સેનિટાઇઝરના સ્ટેશનો ઉપલબ્ધ કરવામાં આવશે
- એક સમયે માર્કેટમાં મુલાકાતીઓની નિયત કરેલ સંખ્યાને જ દાખલ થવા દેવામાં આવશે
- માર્કેટના વિસ્તારમાં પ્રવેશ દ્વાર અને નિર્ગમન માત્ર એક એક જ હશે

સિટી ભલામણ કરે છે કે આ સિઝનમાં દરેક ઘર દીઠ એક જ વ્યક્તિ માર્કેટમાં હાજર રહે.

માર્કેટમાં હોવ ત્યારે સિટી ભારપૂર્વક વિનંતી કરે છે કે ગ્રાહકો એકબીજાથી ભૌતિક અંતર જાળવી રાખે. આનો અર્થ કે પ્રોવિન્સના કટોકટીના હુકમો હેઠળ તમામ સમયે અન્ય લોકોથી બે મીટર (છ ફીટ) દૂર રહેવું સિવાયકે તેઓ તમારા દસ લોકોના સંબંધીઓના જૂથના હોય. પ્રોવિન્સના કટોકટીના હુકમો હેઠળ દસ કરતા વધુ લોકો ભેગા થાય તેના પર પ્રતિબંધ છે. ગ્રાહકોને તે પણ યાદ અપાવીએ કે તેઓએ પોતાનું અંગત ડિસઇન્ફેક્ટન્ટ સાથે રાખવું જેમકે હેન્ડ સેનિટાઇઝર અથવા વાઇપ્સ, વારંવાર હાથ ધોવા અને પોતાના ચહેરાને સ્પર્શ કરવાથી દૂર રહેવું.

શોપિંગને શક્ય એટલું કાર્યક્ષમ બનાવવા માટે વિક્રેતાઓનો નકશો ઓનલાઇન [www.brampton.ca/markets](http://www.brampton.ca/markets) પર અને સાઇટ પર માર્કેટના દિવસોમાં ઉપલબ્ધ રહેશે.

આ વર્ષે બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટને અલ્ગોમા યુનિવર્સિટી (Algoma University) દ્વારા પ્રાયોજીત કરવામાં આવ્યું છે.

સીટી ઓફ બ્રેમ્પટન પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમર્જન્સી મેનેજમેન્ટ ખાતેના તેમના ભાગિદારો સાથે મળીને જોખમો પર દેખરેખ રાખવાનું કાર્ય ચાલુ રાખ્યું છે. નિયમિત અપડેટ્સ માટે [www.brampton.ca/covid19](http://www.brampton.ca/covid19) ની મુલાકાત લો.

### અવતરણો

"આપણા શહેરના ડાઉનટાઉન કોટ વિસ્તારમાં લાંબા સમયથી જેનું આયોજન થતું આવ્યું છે તેવું બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટ આ સિઝન માટે જુનની 27 મીના રોજથી પ્રારંભ થશે તે જાહેર કરતા અમને આનંદ થાય છે! હું આપને ખરીદીનો આનંદ માર્ક પહેરીને લેવા પ્રોત્સાહિત કરું છું તેમજ વિનંતી કરું છું કે ભૌતિક અંતર અને સ્વચ્છતા જાળવી રાખશો. આ વર્ષે હું આપનું ફરી માર્કેટમાં સ્વાગત કરવા ઉત્સુક છું."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટ આપણા સમાજની પરંપરા છે અને તે આ વર્ષે પણ યોજાય તે માટે હું ઉત્સુક છું. સાર્થક પર અનેક બેનમૂન વિક્રેતાઓ હશે અને હું બધાંને વિનંતી કરું છું કે આ વ્યવસાયોને તેઓ ટેકો આપે. સુરક્ષાના જે ઉપાયો લેવામાં આવ્યા છે તેનું પાલન જરૂરથી કરશો જેથી બધાંને શક્ય એટલો શ્રેષ્ઠ અનુભવ માણવા મળે."

- ગૂરપ્રીત ધિલ્લોન, રિજનલ કાઉન્સિલર, વોર્ડ 9 & 10, સીટી ઓફ બ્રેમ્પટન; ઉપ-પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર

"સિઝનની બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટ ખુલે ત્યારે અમારે માટે સમાજની સુરક્ષા અને સ્વાસ્થ્ય ટોચની અગ્રીમતા ધરાવે છે. માર્કેટને માણશો, દીલ ખોલીને ખરીદી કરશો અને સલામતીના પગલાંનું પાલન કરશો. આખી માર્કેટ સિઝનમાં બધાં સાથે મળી આપણે સ્વસ્થ, સલામત અને ખુશ રહી શકીશું."

- પૉલ વિસેન્ટ, રિજનલ કાઉન્સિલર, વોર્ડ 1 & 5, સીટી ઓફ બ્રેમ્પટન; ઉપ-પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર

"ખાસ કરીને COVID-19 દરમિયાન તો સિટી સામાજિક આરોગ્ય અને સુરક્ષા અને સ્વાસ્થ્યને અતિ ગંભીરતાથી લે છે. અ બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટ પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન હેઠળ ખોલી રહ્યા છીએ અને અમે ભારપૂર્વક વિનંતી કરીએ છીએ કે દરેક જાણ રાખવામાં આવેલ સુરક્ષા પગલાંને અનુસરે."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન ફાર્મર્સ માર્કેટ ડાઉનટાઉન બ્રેમ્પટન માટે નિત્ય થનારો પ્રસંગ છે અને મને આ જબરદસ્ત સમાચાર સાંભળીને ખૂબ આનંદની લાગણી થાય છે. આ વર્ષે ડાઉનટાઉન બ્રેમ્પટનના શ્રેણીબદ્ધ વ્યવસાયો વિક્રેતાઓમાં સામેલ છે અને હું રહેવાસીઓને તેમજ મુલાકાતીઓને વિનંતી કરું છું કે તેઓ લોકલ ખરીદી કરે, સુરક્ષિત રહે અને આપણા આ મહાન શહેર અને ડાઉનટાઉનને ટેકો આપતા રહે."

- સુઝી ગોડફ્રોય, એગ્રિક્યુલ્ચર ડિરેક્ટર, ડાઉનટાઉન બ્રેમ્પટન BIA

“બ્રમ્પટન ફાર્મર્સ માર્કેટ એક એવી પરંપરા છે જેનો ભાગ બનવું મારા વ્યવસાય માટે ગૌરવની વાત છે. લોકલ ખરીદી કરવાનું મહત્ત્વ તો હવે તો ક્યારેય ન હતું એટલું છે. આ વર્ષે, હું પેસ્ટ્રી, બ્રેડ અને પ્રિન્ટઝેલ સેન્ડવિચ સાથે માર્કેટમાં ભાગ લઈશ. મહેરબાની કરીને ભૌતિક અંતર અને સ્વચ્છતા જાળવશો જેથી આપણે સહુ સુરક્ષિત રહીને માર્કેટને માણી શકીએ.”

- વેરા ક્સાવેક, માલિક, ક્વિન ગિપ્સી (Queen Gypsy)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)